

હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, મુવાલીયા ફાર્મ, દાહોદ દ્વારા
“સજીવ ખેતી” અંગેની એક દિવસીય કેન્દ્રીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો
તા.૦૭.૧૦.૨૦૧૭

હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલીયા ફાર્મ, દાહોદ ખાતે “સ્ટ્રેન્ધનીંગ ઓફ એગ્રી. પોલીક્લીનીક ફોર ટ્રાયબલ ફાર્મર્સ એટ દાહોદ”ની યોજના અંતર્ગત તા. ૦૭.૧૦.૨૦૧૭ ના રોજ “સજીવ ખેતી” અંગેની એક દિવસીય કેન્દ્રીય ખેડૂત તાલીમ કાર્યક્રમ” યોજવામાં આવેલ હતો. કેન્દ્રીય તાલીમ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના બાવકા, દેલસર, વણભોરી અને દાહોદ ગામના કુલ ૫૦ ખેડૂતભાઈઓ તથા બહેનો, કૃષિ વૈજ્ઞાનિકો, કર્મચારીઓ એ ઉલ્લાસભર ભાગ લીધો..

કાર્યક્રમની શરૂઆતમાં હલકા ધાન્ય સંશોધન કેન્દ્રના ડૉ. એસ. એ. ચૌહાણ, (રિસર્ચ એસોસીએટ) એ પધારેલ ખેડૂતભાઈઓ તથા બહેનો, કૃષિ વૈજ્ઞાનિકો, કર્મચારીઓનું શાબ્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ ડૉ. એમ. એમ. પંડ્યા (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) એ કેન્દ્ર ખાતે ચાલતી શિક્ષણ, સંશોધન તેમજ વિસ્તરણની પ્રવૃત્તિઓ વિશે ખેડૂતોને જાણકારી આપી હતી. વધુમાં તેઓશ્રી દ્વારા એગ્રી. પોલીક્લીનીક યોજનાની ઉપયોગીતા, કેન્દ્રીય તાલીમ કાર્યક્રમ, ક્ષેત્રીય તાલીમ કાર્યક્રમ, રોગ-જીવાતનું નિદાન, જમીન પુથ્થકરણ, સુધારેલી જાતોની પસંદગી વિશે ઉંડાણમાં માર્ગદર્શન આપેલ. ત્યારબાદ ખેડૂતભાઈઓ તથા બહેનો, કૃષિ વૈજ્ઞાનિકો, કર્મચારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. કાર્યક્રમના ઉદ્ઘાટન બાદ કૃષિ નિષ્ણાતો દ્વારા જુદા જુદા વિષયો પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખેડૂતોને માહિતી આપેલ.

શરૂઆતમાં ડૉ. વિકાસ પાલી (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) એ ખેતીમાં સજીવ ખેતીના મૂળભૂત ઘટકો વિશે, કુ. શીતલ પારગી (ખેતી અધિકારી) એ વર્મીકમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિ, સેન્દ્રીય ખાતર તૈયાર કરવાની વિવિધ પદ્ધતિઓ, સજીવ ખેતીમાં જૈવીક ખાતરનો ફાળો, ડૉ. એસ. એ. ચૌહાણ, (રિસર્ચ એસોસીએટ) દ્વારા સજીવ ખેતીમાં સંકલિત ખેતી વ્યવસ્થાપન, લીલા પડવાશનું મહત્વ, વિવિધ ખોળનો ઉપયોગ વિશે માહિતી આપી.

ભોજન વિરામબાદ ડૉ. વાય. બી ચૌહાણ (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) એ સજીવ ખેતીમાં પાક સંરક્ષણ વિશે માહિતગાર કર્યા.

ત્યાર બાદ ડૉ. એમ. એમ. પંડ્યા (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક), ડૉ. એસ. એ. ચૌહાણ (રિસર્ચ એસોસીએટ), કુ. શીતલ પારગી (ખેતી અધિકારી) અને શ્રીમતી વીણા લુહાર (ખેતી મદદનીશ) એ પધારેલ બહેનોને હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર હસ્તકના મ્યુઝીયમ તથા સંશોધન કેન્દ્રની મુલાકાત કરાવેલ હતી. સદર કાર્યક્રમનું આયોજન તેમજ સફળ સંચાલન ડૉ. વાય. બી ચૌહાણ, ડૉ. એમ. એમ. પંડ્યા, ડૉ. એસ. એ. ચૌહાણ, શ્રી એચ. જી. રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતું.

ફોટોગ્રાફ



રજીસ્ટ્રેશન



શાબ્દિક સ્વાગત



દીપ પ્રાગટ્ય



કેન્દ્ર ખાતે ચાલતી “શિક્ષણ, સંશોધન તેમજ વિસ્તરણની પ્રવૃત્તિઓ તેમજ એગ્રી પોલીકલીનીક” વિશે માર્ગદર્શન આપતા વૈજ્ઞાનિક ડૉ. એમ. એમ. પંડ્યા



“ખેતીમાં સજીવ ખેતીના મૂળભૂત ઘટકો વિશે” વિશે માહિતી આપતા વૈજ્ઞાનિક ડૉ. વિકાસ પાલી



“વર્મીકમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિ, સેન્ટ્રીય ખાતર તૈયાર કરવાની વિવિધ પદ્ધતિઓ, સજીવ ખેતીમાં જૈવીક ખાતરનો ફાળો” વિશે વ્યાખ્યાન આપતા કુ. શીતલ પારગી



સંકલિત ખેતી વ્યવસ્થાપન, લીલા પડવાશનું મહત્વ, વિવિધ ખોળનો ઉપયોગ વિશે માહિતી આપતા વૈજ્ઞાનિક ડૉ. એસ. એ. ચૌહાણ

સજીવ ખેતીમાં પાક સંરક્ષણ વિશે માર્ગદર્શન આપતા વૈજ્ઞાનિક ડૉ. વા. બી. ચૌહાણ

એક દિવસીય તાલીમ કાર્યક્રમ અંગેનો ફીડબેક આપતા ખેડૂતભાઈ



હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર હસ્તક મ્યુઝીયમમાં ફિલ્મ સ્ટ્રીપ તેમજ સોયાબીનની જાત વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન આપતા ડૉ. એસ. એ. ચૌહાણ



હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર હસ્તક મ્યુઝીયમ અને કેન્દ્ર ની મુલાકાત લેતા ખેડૂત બહેનો